


3.2.2 Number of books and chapters in edited volumes/books published and papers published in national/ international conference proceedings per teacher during last five years

Renaissance in Europe - Definition & Reason - Dr.N.R.Patel



छा

भारत, रुस, उज्बेक
का समसामयिक सरोकार

प्रयोगकृत
दूषि. अवैष्टि. युवास. मातृ.



₹ 400/-

ISBN 978-93-82554-52-3

9 789382 554523



अद्वैत प्रकाशन

adwaitprakashan@gmail.com

अनुक्रम

आशीर्वाद	(v)
दो शब्द	(vii)
संपादकीय	(ix)
उनका चिंतन और बहुआयामी जीवन : श्री अनिल शास्त्री	13
ममता, त्याग और श्रद्धा की प्रतीक देवी : श्री इन्द्रमणि सिंह रूसी साम्राज्य के विकास में शिक्षा, भाषा-साहित्य	19
तथा प्रकाशन का योगदान : डॉ. प्रदीपकुमार सिंह	31
उज्बेकिस्तान का सांस्कृतिक वैविध्य : डॉ. अनिल सिंह	42
भारत की संस्कृति : डॉ. विनय कुमार	47
रूस का समाज : डॉ. अजय भाई पटेल	52
कालजयी कहानी : कथ्य और तथ्य : प्रो. (डॉ.) अर्जुन चक्राण	57
भूमंडलीकरण के दौर में भारतीय, रसियन और उज्बेकी संस्कृति का योगदान : विजय कुमार सदेश	79
भूमंडलीकरण के दौर में भारतीय संस्कृति का योगदान : डॉ. पुष्पा रानी	83
<u>शूरोप में पुनर्जागरण</u> : परिभाषा तथा कारण :	
डॉ. नरेशभाई रामजीभाई पटेल	92
इतिहास के आईने में रूस : प्रो. सत्यनारायण राव	98
रूस की सांस्कृतिक चेतना : डॉ. सविता सिंह	104
उज्बेकिस्तान : समाज तथा भाषा : प्रा. गोविंद मुरारका	111

यूरोप में पुनर्जागरण : परिभाषा तथा कारण

डॉ. नरेशभाई रामजीभाई पटेल

प्राचीन काल में सांस्कृतिक, आध्यात्मिक और वैचारिक आंदोलन का प्रणेता भारत को माना जाता था। इसी प्रकार आधुनिक काल में पुनर्जागरण, प्रगति-तंत्र सहित कई विचाराचारी यूरोप से प्रवाहित हुई, जिससे आधुनिक युग का सुन्तापत हुआ। जिस प्रकार प्राचीन काल का वैचारिक नेतृत्व भारत (विद्योपकर बिहार—बीदू धर्म, जैनधर्म, लिङ्गाचारी गणतंत्र का प्रादुर्भाव यहीं से हुआ) ने किया, उसी तरह भव्यकाल का वैचारिक नेतृत्वकारी हम यूरोप को मान सकते हैं। विश्व के सात महाद्वीपों में यूरोप दूसरा सबसे छोटा महाद्वीप है। पुनर्जागरण की प्रक्रिया पंद्रहवीं शताब्दी से विश्व-स्तर पर शुरू हुई, विस्तर संसूचित विश्व में घीर-घोर प्रभाव पड़ा। पुनर्जागरण के पश्चात भव्यकालीन कूप-मैदूरुता टूट हुई और तत्त्वज्ञानक विश्लेषण का दौर शुरू हुआ। नवीन दृष्टियाँ की खोला यूरोप ने की थी। असीका और एशिया में औपनिवेशिक, आपारिक तथा ईसाई धर्म के प्रवाह की गतिविधियाँ यूरोप ने की थीं। विश्व के एक भाग को, दूसरे भाग के साथ घनिष्ठ संबंध से जोड़ने वाला यूरोप था और उसमें भी विशेष लीला पर, विशेष यूरोप था। आधुनिक युग के प्रारंभ में पश्चिमी यूरोप में व्यापक सांस्कृतिक जागृति निलेज हो गई और उसके स्वायत्र पर नवीन भौतिक विकास की व्यापक गतिविधियाँ प्रारंभ हुईं। यह सांस्कृतिक पुनर्जागरण कहलाता है। इसका सूत्रात इटली से हुआ, परंतु जब्ती ही इंग्लैंड, फ्रांस, स्पेन, जर्मनी, नीदरलैंड आदि उभी परिवर्ती यूरोपीय देशों में व्याप्त हो गया।

92 / भारत, उत्तर, उत्तरोत्तर का समयावधिक संरोक्तार

पुनर्जागरण से अभिप्राय

पुनर्जागरण का आशय भव्यकालीन विश्वखलता में सोई हुई सम्भता को, प्राचीन गौव्य-रोपन आदर्शों के आधार पर जगाने से है, जर्मान् प्राचीन ग्रीको-रोपन संस्कृति के उपर्युक्तवाल से है। आधुनिक युग के प्रारंभ में पश्चिमी यूरोप में 1453 ई. से 1650 ई. तक संहिता, चिकित्सा, मूर्तिकला, वास्तुकला, दर्जन, विज्ञान आदि सेव में और भी गतिविधियाँ हुईं, वाहे उनका आधार प्राचीन ग्रीको-रोपन संस्कृति रहा हो या उनका नया विकास हुआ हो, का अध्ययन पुनर्जागरण के तहत किया जाता है। स्वयं है कि पुनर्जागरण का उद्देश्य ग्रीको-रोपन संस्कृति की तरफ नवीन विचारों के आधार पर इन नुस्खों पुनः आकर्षित करना ही नहीं था, अपितु इसके नवीन विचारों के आधार पर इन नुस्खों भविष्य का सूजन करना भी था। इस जब्त का प्रयोग आधारक अर्द्ध में किया जाना चाहिए। प्रसिद्ध इतिहासकार रोबर्ट एर्डोन्स लिखते हैं, सांस्कृतिक पुनर्जागरण का आशय भव्य-युग से आधुनिक युग को लाने वाले उन सभी परिवर्तनों में है, जैसे—सामंती व्यवस्था का पतन, प्राचीन साहित्य के अध्ययन और प्रतीति अभिनव, राष्ट्रीय राज्यों का उत्कर्ष, आधुनिक विज्ञान का आरोप, गतिशील जगतों एवं तात्त्वात्मकों का आविष्कार, वालद, युत्तुबनुमा का आविष्कार, नवे व्यापारिक शरण की लोक, नए देशों तथा अमेरिका की खोज तथा प्रारंभिक यूरोपीयोंके लिये विकास है। ऐसे ही विचार फिशर ने भी व्यक्त किए हैं, सर्वप्रथम इटली के नगरों में प्राचीन कूपाची एवं गोपन कला, साहित्य, संस्कृति का पुनर्जनन, मानवतावादी आंदोलन का प्रारंभ, पार्मिंग हेब में प्राचीन यूनानी सभ्यता का समावेश, स्वायत्रण एवं विज्ञकला का नवीन व्यवस्था, व्यक्तिवादी एवं स्वतंत्र व्यापार के सिद्धांतों का विकास, नवीन लोक, नव दृष्टिकोण, वैज्ञानिक एवं ऐतिहासिक आलोचना, आपाधानों का अधिकार, दर्जन एवं पर्वशास्त्र का नवीन स्वरूप तथा विवेचन आदि विशेषताओं को सम्मूलिक स्वरूप से संरचित करने का पुनर्जागरण कहते हैं। डॉ. डक्टरू सुउदयगेट भी लिखते हैं—“पुनर्जागरण के तहत अन्वेषण की भावना का विकास हुआ, विचाराचारा एवं कार्य में स्वतंत्रता की भावना का विकास हुआ, अब भूतकाल की शिक्षाओं, अधिविज्ञानों तथा परंपराओं को जिन प्रश्न किए लीग स्वीकार करने को सहमत नहीं थे। मध्ययुगीन संस्थाओं के प्रति एक आलोचनात्मक प्रकृति थी, जो वक्त के साथ बढ़ती गई।”¹²

इस प्रकार पुनर्जागरण के उपरांत संपूर्ण यूरोप में वैचारिक स्तर पर कानून उत्पन्न हुई। जनता का जीवन के प्रति गोह पैदा हुआ। सांसारिक सुखों ने भी

यूरोप में पुनर्जागरण : परिभाषा तथा कारण / 93

ભારતીય ભાષા લોક સર્વેક્ષણ

ગુજરાત, દીવ-દમણ અને દાદરા-નગર હવેલીની ભાષા
ગ્રંથ ૮, ભાગ ૩



મુખ્ય સંપાદક
ગણેશ ટેવી

સંપાદક
કાનજી પટેલ

bhasha



ભારતીય ભાષા પાઠ સર્વેકાશ - મુજફાત, દીપ-દમણ અન રાહા-નાર લોગોની ભાષા, શંક દ, ભાગ ૩

ઓરિએન્ટ બ્લેકસ્વાન પ્રાઇવેટ લિમિટેડ

મુખ્ય અધ્યક્ષ

૩-૬-૭૫૨ દિલ્લીપટે નાર, હેરાલાદ ૫૦૦ ૦૨૫ (તેકાળી), આરા

ઈ-મેલ : centraloffice@orientblackswan.com

સાધારણ

નોંધાર, લોધાં, કુદરાં, કાચાંથા, ચેપાં, અર્નાંથ, કુદાંથ,
હેરાલાદ, જ્યાંથ, તનનાંથ, મુનાંથ, નાંથ ટિંથી, નોંઠા, પના, વિનાંથ

© ભાષા રિસર્વ એન્ડ પાન્ડરિશન સેન્ટર, પ્રોફેટ

પ્રથમ સંભારણ ૨૦૧૫

શંક દ, ભાગ ૩

ISBN : 978-81-250-6112-0

પુનાદ સંખા : ઓરિએન્ટ બ્લેકસ્વાન

સાધારણ સંખા : પારાલ કુદાંથ

ટાઇપ સેટિંગ : ભાષા રિસર્વ એન્ડ પાન્ડરિશન સેન્ટર, ચ્યેટા દાર શીર્ષિંધુ ગુજરાતી પ્રા. ૧૨/૧૪૦૦-૨૦૧૫

સ્ક્રેન : ઓરિએન્ટ પ્રિન્ટિંગ, દિલ્લી

પ્રકાશન

ઓરિએન્ટ બ્લેકસ્વાન પ્રાઇવેટ લિમિટેડ

૧/૨૪ અસ્ટ્રે નારી રોડ

નાંથ ટિંથી ૧૧૦ ૦૦૨

ઈ-મેલ : delhi@orientblackswan.com

Maps by


Sangam Books (India) Private Limited

Hyderabad

The following are applicable for the maps in this book:

1. © Government of India. Copyright 2015.
2. The responsibility for the correctness of the internal details rests with the publisher.
3. The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base line.
4. The external boundaries and coastlines of India agree with the Record/Master Copy certified by the Survey of India vide their letter No. T.B. 645/62-A-3/A dated 3 December 2015.
5. The spelling of names in the maps have been taken from various sources.

ભારતીય ભાષા પાઠ સર્વેકાશ માટે જનરેલ ટાઈ સ્ટાટ મુનાંથી નંદા અન્ધા સર્વેકાશ કર્યો છે.



ગરાસિયા

હસુ યાણિક, ભગવાનદાસ પટેલ, પ્રભુદાસ પટેલ

ગરાસિયા બીજી


બનાસકાઢા અને સાબરકાઢાના દાંતા વળેના વિસ્તારમાં ગરાસિયા બીજ અને કુંગરી બીજ એવી બીજોની બે લાટિઓનો વસવાટ છે. ગરાસિયા બીજના પણ બે પ્રકાર-લાતિગત પેટા પ્રકાર છે. જેમાં ગરાસિયા અને સોખલા ગરાસિયાનો સમાવેશ થાય છે. તે બજે પેટાનાનિયોની ભાષાઓનો સમાવેશ બીજીમાં થાય છે અને તેમનાં હંડ-પરંપરાના સાહિત્ય, ધર્મ, શાસ્ત્ર અને સામાજિક રીતરિવાજ તથા વિધિવિધાનમાં કેટલોક પાયાની સમાનતા હોવા જાતા નાતિગત, ઉત્પત્તિ, કુણ્ણાણી રાણીને કેટલોક જિંદગી પણ છે. જેથી એમની ભાષામાં પણ કેટલોક મહત્વનો ભાષાકીય તફાવત પણ છે.

ગરાસિયા બીજ લાતિનો વસવાટ ગુજરાતના દાંતા, અમીરગઢ અને બેઠથલા તાલુકાઓમાં આવેલી અરવકી પદ્ધાડની ટેકરીનાં ગાચોએં છે. ગરાસિયા અને સોખલા ગરાસિયા એ બજે પેટાનાનિયોનો સમાવેશ આદિવાસી બીજોની મુખ્ય લાટિઓના થનો હોબાથી તે બજે પેટાનાનિયોના અવગ અલગ ભાષકસેખ્યાના આંકડા મળતા નથી. આથી ઈ.સ. ૧૯૮૮ની વાણતરી પ્રમાણે બાધક સંખ્યા ૧,૪૮,૬૨૦ છે, જેમાં મુખ્યની સંખ્યા ૭૬,૦૮૮ અને જીઓની સંખ્યા ૭૨,૮૬૨ છે.

ગરાસિયા બીજોની લાતિનો વસવાટ રામલાલથી રતનપુરાં છે. દાંતા તાલુકાનાં રાણપુર વાગે ૧૪ કેટલાં ગામડાંમાં, લેટિયાપાણી(કાનપુર) જેવા અમીરગઢના વિસ્તારમાં સોખલા ગરાસિયાનો વિરોધ વસવાટ છે. દાંતા-અમીરગઢના તાલુકાની ઉન્ન દિશાએ આગળ વથતાં રાજસ્થાનની સીમા આવે છે. આથી આ પદ્ધીની નાણક વસતા સોખલા ગરાસિયાના ભાષા, જીવન-પદ્ધતિ અને સંસ્કૃતિ પર રાજસ્થાનની વિરોધ અસર છે.

બીજી ભાષાનાં કુલ મૂળ અને પેટા -પ્રકાર

બીજોની વસ્તી ગુજરાતના ઉત્તર પદ્ધિમ ભાગથી આવેનીને તે છેક દક્ષિણ ગુજરાતના ડાંગના વિસ્તાર સુધીમાં છે. આમાં મુખ્ય બીજ આદિવાસી જાતિ ઉપરાં અન્ય ૨૩-૨૪ કેટલી બીજ તરફી, રાઠવા, મુણબા, ધોડિયા, ચૌધરી જેવી આદિવાસી જાતિઓ છે અને તેમની ભાષાઓ જુદી મનાતી હોવા હુંતા એ બજી જ ભાષાઓનો મૂળ બને કુળનો સંખ્યા બીજી સાથે છે. આ મૂળ બીજોનો જન્મ ઈ.સ. ૮૫૦ પછી નવી અવધીન આર્થિકભાષાઓ જન્મો તેની સાથે છે. આ ગામાની રાજસ્થાન-ગુજરાતની શોલસેની અધિકારીઓની જાન્મેલી ચિહ્નની જેને Old Western Rajasthani કહીને અને ઉત્તરાંદ્ર જેનોએ એને મારુ-ગુજરાત ભાષા તરીક ઓળખાવી તેની સાથે છે. પદ્ધિમની નવમી સહીથી જાન્મેલી આ મુખ્ય ભાષામાંથી જ જેમ ગુજરાતી અને રાજસ્થાની બેઝ જ મુખ્ય ભાષાઓ જુદી પદી, તેમ જે કાળ રાજસ્થાન-ગુજરાતના મારુ-ગુજરાત ભાષા બોલતી હતી તે સમયે ચારણ જાતિઓનું ભાષાનું સ્વરૂપ પણ મારુ-ગુજરાત હતું, એનો કુળગત સંખ્યા જોરસેની અપણેં સાથે જ હતો અને તેમાંથી ચારણ-



MADHYAKALIN PADHYAKRUTI VIMARSH

A collection of Essays on scholars of Jain literature and Research

Edited by

Dr. Abhay Doshi and Dr. Sejal Shah

Published by

Shri VeerTatva Prakashak Mandal Samadhi Mandir,

- VTP chowk, Shivpuri - 473551

Mukeshji Bhandavat.

M.No. 09425136615

Shri Roop Manek Bhanshali Cheritable Trust

128/129, Mittal chambers

228 Nariman Point, Mumbai 400 021

Phone : 022-66376491

પ્રથમ આવૃત્તિ ૨૦૧૬

પ્રક. - ૩૦૦

કિલો : ૫૦૦/-

ISBN : ૯૭૮-૮૩-૮૩૮૧૪-૫૮-૬

પ્રાસિસ્થાન

શ્રીરૂપ માર્કેટ બંશાળી ચેરિટેબલ ટ્રસ્ટ

૧૨૮/૧૨૮, મિતલ ચેમ્બર્સ,

૨૨૮, નરિમાન પોઈન્ટ, મુંબઈ ૪૦૦ ૦૨૧

ફોન : ૦૨૨-૬૬૩૭૬૪૫૭

ગૂજરાતી એજન્સી

રતનપોળનગર સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧

ફોન : ૨૨૧૪૪૬૬૩

ટાઇપસેટિંગ

શારદ્ય મુદ્રણાલય

૨૦૧, તિલકચંદ્ર, પંચવડી પહેલી લેન, એલિસબ્રિજ, અમદાવાદ-૬.

ફોન: ૨૬૫૬૪૨૭૮

મુદ્રક

ભગવતી એફસેટ, અમદાવાદ

‘સ્થૂલિભદ્રવિષયક ફાગુકાવ્યોમાં ભાવપક્ષ અને કળાપક્ષની તપાસ’


◆ ડૉ. પ્રભુદાસ આર. પટેલ

જૈન સાહિત્ય બહુધા વિરક્ત સાધુઓ દ્વારા રચાયું છે. તેથી તે મોટા ભાગે ધર્મમૂલક રહ્યું છે. જૈન ધર્મના પાયામાં ત્યાગ અને સંયમ જેવા ભાવો રહેલા છે. તેથી તેમની ફાગુરચનાઓમાં આરંભમાં સંયમિત રૂપે શૃંગારરસનું નિરૂપણ અને અંતે સંયમ, ત્યાગ કે ઉપશમમાં પરિણમતું હોય તે પ્રકારનું નિરૂપણ વિશેષ સાંપદી છે. જૈન કથાનકોમાં નેમિનાથ અને સ્થૂલિભદ્ર જેવાં ચરિત્રો સાથે સંકળાયેલ જીવનપ્રસંગોમાં વસંતક્રતુ નિમિત્તે શૃંગારરસ નિરૂપવાનો અવકાશ છે. તેથી જ સૌથી વધુ ફાગુરચનાઓ નેમિનાથ - રાજુલ અને સ્થૂલિભદ્ર - કોશાના કથાનક ઉપર રચાયાં છે.

કથાવસ્તુ ગૌતિક હોય કે ધર્મપ્રધાન - તે સર્જકની કલમે અવતરે છે ત્યારે તેનું પોતીકું બની જાય છે. પ્રત્યેક ઇતિમાં સર્જકપ્રતિભાના સંસર્જની કશાકને કશાક, વિશેષ ઉન્મેષો બજી થાય જ છે. તેથી જ એક જ વિષય આધ્યારિત એકાધિક રચનાઓમાં અલગ-અલગ ભાવનો અનુભવ થાય છે. નેમિનાથ કે સ્થૂલિભદ્ર જેવા મહાન ત્યાગાઓનાં ચરિત્રો જૈન સર્જકોએ સહેતુક પસંદ કર્યાં છે. કેમ કે દેરાજ્ય કે ભક્તિના કોરાકટ ઉપદેશને બદલે આવા સંયમશીલ ચરિત્રોને શૃંગારિક ભૂગ્રિકાએ મૂકીને, અંતે વિજ્ઞી થતા દર્શાવાય તો બોધ પ્રભાવક રૂપમાં ભાવક જીવી શકે. આવા ધર્મપુરુષો, ત્યાગી-શ્રાવકોના ચરિત્રો માટે ગવાયેલાં સ્તવનો ભલે સંસારની - અસારતા કે ભાષાલાલિત્ય જોઈએ તો સાધુચિત્તમાંય રહેલો કર્તિ બાંધ્યે જ છૂપો રહેશે. અહીં મારો ઉપકમ સ્થૂલિભદ્ર વિષયક રચનાઓના ભાવપક્ષ અને કલાપક્ષ ઉભયની તપાસ કરવાનો રહેશે.

અત્યાર સુધી સ્થૂલિભદ્ર અને કોશાના કથાનક સાથે સંકળાયેલાં ચારેક ફાગુકાવ્યો સાંપદી છે: (૧) જિનપદસૂર્ચિકૃત ‘સ્થૂલિભદ્ર કણ.’ (૨) હલરાજકૃત ‘સ્થૂલિભદ્ર કણ.’ (૩) જીવંતસૂર્ચિકૃત ‘સ્થૂલિભદ્ર - કોશા પ્રેમવિલાસ કણ.’ અને (૪) માલદેવકૃત ‘સ્થૂલિભદ્ર કણ.’

આ ચારેય રચનાઓમાં સ્થૂલિભદ્ર - કોશાનું કથાનક જુદીજુદી રીતે વસુગ્રથન પામનું હોઈ સ્થૂલિભદ્રના જીવનવિષયક સંક્ષિપ્ત રૂપરેખા જાણ્યા પછી આ ઇતિઓની તપાસ કરીએ:





ISBN-978-93-82173-73-1

(C) Dr. Jasarajbhai chaudhari

પ્રથમ આવૃત્તિ : ૨૦૧૬, પ્રતિ : ૫૦૦, મૂલ્ય : ૧૫૦/૦૦

પ્રકાશક :-

ડૉ. સ્વામી ગૌરાંગશારણાટેવાચાર્ય
અરાવલી પ્રકાશન
'શ્રીપંચમુખી' મુદ્દિર
પોસ્ટ બોક્સ નં. ૧૧
હિંમતનગર (સાબરકાંઠા)
મો.નં. ૮૪૨૮૧ ૭૮૮૫૪


ટાઈપ સેટીંગ

શ્રી નિમાર્ક મીડિયા પબ્લિકેશન
હિંમતનગર
મુદ્રક :
શ્રીવિદ્યા ઓફસેટ
પો.બો.નં. ૧૧, હિંમતનગર

Sabarkantha jilla na lokmelao

By Dr. Jasarajbhai chaudhari

===== સાબરકાંઠા જિલ્લાના લોકમેળાઓ - ૨ =====





ISBN-978-93-82173-72-4

(C) Dr. Jasarajbhai chaudhari

પ્રથમ આવૃત્તિ : ૨૦૧૬ , પ્રતિ : ૫૦૦ , મૂલ્ય : ૧૫૦/૦૦

પ્રકાશક :-

ડૉ. સ્વામી ગૌરાંગશરણાટેવાચાર્ય
અરાવલી પ્રકાશન
'શ્રીપંચમુખી હનુમાન મંદિર'
પોસ્ટ બોક્સ નં. ૧૧
હિંમતનગર (સાબરકાંઠા)
મો.નં. ૮૪૨૮૭૧ ૭૮૮૫૪

ટાઈપ સેટીંગ

શ્રી નિષ્ઠાક મીડિયા પાઇલકેશન
હિંમતનગર
મુદ્રક :
શ્રીવિદ્યા એફસેટ
પો.બો.નં. ૧૧, હિંમતનગર

Aravalli jilla na lokmelao

By Dr. Jasarajbhai chaudhari

===== અરાવલી વિદ્યાળા લોકમેલાઓ .. ર =====

॥ ॐ ॥

महाकविकालिदासविरचितम्

कुमारसम्भवम्

(सुबोधिकाटीकासहितम्)

प्रा.डॉ.मनुभाई डी. परमार

संस्कृत विभाग,

आर्ट्स कॉलेज, वडाली

जि. - साबरकांठा, गुजरात

प्रकाशक

ग्रीन फ्लेग फाउंडेशन

सोनासण, जिल्ला :साबरकांठा , गुजरात राज्य ,

पिन, ૩૮૩૨૧૦

C Pro. Dr. Manubhai D. Parmar

पुस्तक के लिये भी इस या भजनियत पुस्तक का किसी अन्य साहित्यी हमेशा उन्होंने नहीं करने वा फोटो कीपी बदले से पहले लेखक की पूरी समर्पित रूपा आवश्यक है। वही उसे कोई दाइट एवं कस उत्तरण माना जाएगा और ये कानूनी तरीं पर अवधार है।

ISBN 978-93-86366-46-7

प्रकाशन वर्ष

आगस्त, २०१७

टाइप & सेटिंग

भरत बी. पटेल

एकसेलेस कॉम्प्युटर सेन्टर, हिमतनगर

प्रिन्टिंग & बाइंडिंग

भगवती प्रिंटिंग प्रेस, हिमतनगर

प्रकाशक

ग्रीन फ्लेग फाउंडेशन

सोनासण, जिल्ला : साबरकांठा, गुजरात राज्य, पिन. ३८३२१०

एक प्रति का मुल्य: 325/- रु.

अंक्रमणिका

१. प्रथमः सर्वः	०७
२ द्वितीयः सर्वः	३९
३ तृतीयः सर्वः	६६
४ चतुर्थः सर्वः	१०६
५ पञ्चमः सर्वः	१२५
६ षष्ठः सर्वः	१६८
७ सप्तमः सर्वः	२०३

सुभाषितमाला

संपादक

प्रा.डो. मनुभाई डी. परमार
संस्कृत विभाग
आर्ट्स कोलेज, वडाली
(गुजरात)

प्रकाशक

ग्रीन फ्लेग फाउंडेशन
सोनासण, जिल्ला :साबरकांठा , गुजरात राज्य ,
पिन, ૩૮૩૨૧૦

© Pro. Dr. Manubhai D. Parmar

प्रस्तुतक के किसी भी भाग या समुद्दिष्ट प्रस्तुतक का किसी गलत स्वरूपों इत्येतत्व करने या फोटो की करने से पहले लेखक की पूर्व सम्मति लेना आवश्यक है। किसी उसे बोर्ड राइट प्रकट का उन्नयन माना जाएगा और ये कानूनी तौर पर अपराध है।

ISBN 978-93-86366-47-4

प्रकाशन वर्ष

अगस्त , २०१७

टाइप & सेटीग

भरत बी. पटेल

एकसेल्स कॉम्प्युटर सेन्टर , हिमतनगर

प्रिण्टिंग & बाइंडिंग

भगवती प्रिंटिंग प्रेस, हिमतनगर

प्रकाशक

गीन प्लेग फाउंडेशन

सोनासण, जिला : साबरकांठ, गुजरात राज्य, पिन. ३८३२१०

एक प्रत का मूल्य: 225/- रु.

सुभाषितमाला

अज्ञानतिमिरान्धस्य जनाङ्गजनशलाक्या ।

चकुरन्मिलितं येन तद्वै श्रीगुरवे नमः ॥ १ ॥

अज्ञानरूपी अन्धकार से अन्धे हुए मनुष्य की आँख को
ज्ञानरूप अञ्जन से छोलनेवाले उस गुरु को मेरा प्रणाम ॥

पृथिव्यां ब्रह्मि रत्नानि जलमन्नं सुभाषितम् ।

मूढः पादाणखण्डेषु रत्नसंज्ञा प्रदीयते ॥ २ ॥

जल, अन्न और सुआषित - यह तीन पृथ्वी में रत्न हैं।
पत्थर के टुकड़े को मूर्ख लोगों ने ही रत्नसंज्ञा दी है।


द्राक्षा म्लानमुखी जाता शक्रा चाशमतां गता ।


तुभाषितरसं दृष्ट्वा सुधा भौता दिवं गता ॥ ३ ॥

सुभाषित रस को देखकर द्राक्ष का मुख म्लान हो गया,
शक्रा पत्थर बन गई और अमृत डरकर स्वर्ग में चला गया।

अल्पानामपि वस्तुनां संहतिः कार्यसाधिका ।

तृणैर्गुणत्वमापन्नैः बध्यन्ते मत्तदन्तिनः ॥ ४ ॥





કિન્તુ : ₹ 225

પહેલી આવૃત્તિ : કેવુંઅન્ની, 2017

ADHIT OGANCHALISH

*Edited by J. M. Chandravadia, Bharat Pandya, Sanjay Makwana,
Ganpat Sodha, Naresh Vaghela*

Published by Gurjar Agency, Ahmedabad-380006 (India)

ISBN: 978-93-5162-411-0

પૃષ્ઠ: 4+212

પ્રકાશક: ગુજરાતીનો અધ્યાપક સંઘ વતી ગૃહીર ગ્રંથાલય
અમદાવાદ દક્ષિણાંગ શાહ: રતનપોળનાડા સામે, ગોઢી માર્ગ, અમદાવાદ-380001
ફોન: 22144663 ■ e-mail: goorjar@yahoo.com

ટાઇપસેટિંગ: શારદા મુદ્રણાલય
૨૦૧, તિલકગાજ, પંચવડી પહેલી લેન, એલિઓનિઝ,
અમદાવાદ-૩૮૦૦૦૬ ફોન: 2656 4279


મુદ્રક: ભગવતી ઓફસેટ
સી/૧૬, બંસીધર એસેટ, બારડોલપુર, અમદાવાદ-૩૮૦૦૦૪

‘પોળોના પાદરમાં’ : આરણ્યક સંસ્કૃતિને ઉજાગર કરતા નિબંધો

ડૉ. પ્રભુદાસ આર. પટેલ

‘પોળોના પાદરમાં’ એ ડૉ. હિનેશ પટેલિયા રચિત પોળો અને તેની આસપાસ પ્રાકૃતિક પ્રદેશમાં ચસતા લોકોની સાંસ્કૃતિક જીવનની ધબકને આવેજતો નવ લખિત નિબંધોનો સંચય છે. આ સંચયને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે. આ સંચયની પ્રથમ રચનામાં જ ‘પોળો સાથેનો મારો નાભિ-નાળનો સંબંધ’ એમ કહી અરણ્યભૂમિ અને સંસ્કૃતિ સાથે આતીયતાનો ઓડકાર પ્રગટ કરનાર આ સર્જક પોળોથી દરેક કિ.મી. દૂર તેમનો જન્મ થયો હોઈ તથા પોળો નજીક જ તેમની જમીન-ઘર હોઈ આ સ્થળો અને સંસ્કૃતિથી ઠીકઠીક વાકેફ તો હશે જ, પરંતુ અધ્યાપકીય સજજતા અને કેળવાયેલી સાહિત્યરુચિએ કે જીવનરુચિને લીધે એ બધું રચનાને સરાંશો ચેઢે છે ત્યારે આમવાચકનેય પ્રકૃતિ-જીવનરુચિને લીધે એ બધું રચનાને સરાંશો ચેઢે છે ત્યારે આમવાચકનેય પ્રકૃતિ-જીવનરુચિને લીધે એ બધું રચનાને સરાંશો ચેઢે છે. આ સર્જકને પહાડો, અરણ્ય, નદીઓ, સંસ્કૃત માટે સમભાવ પ્રેરક બની રહે છે. આ સર્જકને પહાડો, અરણ્ય, નદીઓ, જરણાં, પ્રાચીન મંદિર, મૂર્તિઓ ઉપરાંત અરણ્યજનોની નોભી-અનોભી પરંપરાઓમાં રસ હોઈ ‘પોળોના પાદરમાં’ના નિબંધો મહદુંથો એ જ વિષયવસ્તુને તારો છે.

આ સંચયની ‘પોળોથી પોળો’, ‘વાઘમારુથી વીરેશ્વર’, ‘શારણોશરના મલકમાં’ અને ‘હરણાવને કંઠે’ જેવી રચનાઓમાં પોળોનું અરણ્ય, પ્રાચીન મંદિરો અને વનવાસી લોકસંસ્કૃતિ, હરણાવ નદી વગેરે પ્રત્યક્ષ-પરોક્ષ રૂપે લિલાયાં છે. પ્રથમ રચના ‘પોળોથી પોળો’ સંગ્રહની શરીરકસ્થ રચના છે. જેમાં પ્રારંભે જ ‘પોળો’ નામકરણ સંદર્ભે શબ્દવ્યુત્પત્તિ, તર્ક-વિતર્કને અંતે દશ્ય અર્થઘટન કરતાં સર્જકની ઉત્ખનનવૃત્તિનાં દર્શન થાય છે. તો રજવાડાયુગીન ગુજરાત-ગાજુસ્થાન સીમાંડન - ઐતિહાસિક લોકદંતકથા, પોળોના દુંગરો - પહાડીઓ અને દુંગરદેવીઓની લોકકથાઓ - માન્યતાઓ, પોળોમાંથી પસાર થતી હરણાવ નદી, મમરીસી તળાવ, આદિમ પ્રજા કાથોડીઓનો વન્યપ્રાણીઓ પર પ્રભાવ અને તેમની ખાણીપીણી, પોળોના હદ્ય સમાં પ્રાચીન સ્મારકો - સતીમાતાની દરી - આ બધાંનાં વર્ણનો, જનશુદ્ધિઓ અને લોકમાન્યતાઓના નિરૂપણને લીધે ભાવકને સભરતાનો અનુભવ થાય છે તો આ પ્રકારના નિરૂપણમાં સર્જકની પ્રકૃતિ અભિન સર્જકમુદ્રાય અછતી





લા.ડા.નાં નાટકો

૪૪. એક ઉદર અને જહુનાથ : લાખ જીવ, એક મુસીબત
જયતી દલાલ ૩૦૪
૪૫. કુદરતી : જીવન એ લીલા છે ૩૦૮
નીતિન મહેતા
૪૬. બાથટબમાં માછલી અને વૃક્ષ : નાટકની ભાષા શોધવાની મથામણ. ૩૧૨
જયતી ગાડીઠ
૪૭. લા.ડા.ની નાટ્યસૂચિ ૩૧૯
રાજેન્ડ્ર મહેતા
૪૮. લાભશંકર ઠાકરની એકાંકીકલા ૩૪૩
સતીશ વ્યાસ
૪૯. પીળુ ગુલાબ અને હું : નાટકમાં નાટક અને સ્વીનિર્માતાનું પાત્ર.... ૩૫૦
પ્રભુદાસ પટેલ
૫૦. 'કાઢે કોયલ શોર મચાયે રે' ૩૭૯
સતીશ વ્યાસ
૫૧. મકસદ : ના, બળવા-બાળવાનો નહીં, મળવાનો ! ૩૮૪
રમેશ ર. દવે
૫૨. મકસદ ૩૮૯
રઘુવીર ચૌધરી
૫૩. 'રમત' વિશે લા.ડા. સાથે રમત ૩૮૪
મહેન્દ્રસિંહ પરમાર
૫૪. ફેન્ટસી અને નાટકકાર લાભશંકર ૩૮૮
ચિન્તુ મોદી
૫૫. ખાલી પર્દા પર 'ટિલડી' અને લા'કાકા ૪૦૪
હિવા (પાણ્ણેય) ભક્ત
૫૬. લાભશંકર ઠાકરનાં નાટકોમાં ભંગુરતાના વિવિધ વિવતો ૪૧૨
પારુલ કદર્દી હેસાઈ


લા.ડા.ની નવલકથાઓ

૫૭. 'કોણ ?'માં અસ્તિત્વવાદી અંશો ૪૨૧
વિજય શાસ્ત્રી
૫૮. ધરા : તીખી-તમતમતી છતાં મનભાવન ૪૩૧
રમેશ ર. દવે





પદ્ધતિન વિશ્વકોશ



Sarth Publications
Publishers & Distributors

a 502, Virani Chamber, Opp. Taskent Petrol Pump, Sardar Ganj, Anand 388001 (Gujarat)

m 097379 31777 | 094265 83589

e sarthpublication1978@gmail.com




9 789387 815049

₹ 2195/- (Each Vol.)

Set in 5 Vols.

NATYNIKARSH -DR.P.R.PATEL



NATYANIKASH
(Articles on Drama)
Written by Prabhudas Patel
Pranav Prakashan, Ahmedabad
2018

ISBN : 978-93-83174-68-3

© ડૉ. પ્રભુદાસ પટેલ

પ્રથમ અવૃત્તિ : ૨૦૧૮

પ્રત : ૫૦૦

મૂલ્ય : ₹ ૧૨૦.૦૦

પ્રકાશક :

ડૉ. પ્રભુદાસ પટેલ
'દુશ્શાલાશયમ', મુ. પો. રાજ્યપુર,
તા. વિજયનગર, જી. સાલરકારા

પ્રકાશનબયવસ્થા અને મુખ્ય વિકેતા

પ્રશ્નાં પ્રકાશન

૩૦, બીજે માળ, દૃષ્ટિ કોમ્પ્લેક્સ,
જૂન મેડલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭
ફોન : ૨૨૯૬૭૨૦૦, ૮૮૨૫૦૫૭૮૦૫
E-mail : pranavbooksworld@gmail.com
Web : www.divinepublications.org

ટાઇપસેટિંગ : ડ્રાઈલસ ગ્લાફિક્સ, અમદાવાદ

મુદ્રણ : ચુનિક ઓફસેટ, અમદાવાદ



ગુજરાત આહિન્ય અકાદમી, ગાંધીનગરની આહિન્ય સહાયથી પ્રકાશિત

INNOVATIVE PERSPECTIVES ON BODY, MIND & SOUL

: Editors :

* Dr. Kavita J. Patel

* Dr. Vijay Singh Paderiya

* Dr. Bimal Joshi

* Dr. Pinal Solanki



Akshar Book Agency, Ahmedabad

Innovative perspectives on Body, Mind & Soul

Dr. Kavita J. Patel, Dr. Bimal Joshi, Dr. Vijay Singh Paderiya, Dr. Pinal Solanki

Publishers : Akshar Book Agency
Shreeji House,
B/h. M. J. Library,
Books India Lane,
Ellisbridge, Ahmedabad.
Phone : 079-26585888

Edition : 2019

ISBN : 978-93-85540-66-6

Type Setting : Akshar Book Agency
Shreeji House,
B/h. M. J. Library,
Books India Lane,
Ellisbridge, Ahmedabad.
Phone : 079-26585888

Printer : Shreeji Offset,
Dhudheshwar, Ahmedabad.

Copy : 500

INDEX

1.	Bhagyanbhai J. Bharwad A Study The Effect of Yogasana on Obesity Among Selected School Boys	1
2.	Chaudhari Anantkumar R., Chaudhary Virjibhai R. A study of effects on legs explosive strength by Yoga Training	6
3.	Dr. Ashwin H. Patel Necessity of Physical Fitness & Wellness Programme in Higher Education	8
4.	Dr. Bharat Z. Patel, Dr. Bharat M Patel a study of national road cycling championship events	11
5.	Bhartiben Brahmabhatt A Study of Effects on Pulse Rate and Vital Capacity by	16
6.	Dr. Dipak K. Sheth Sports for Development and Peace	19
7.	Dilipkumar S. Patel sports injuries and rehabilitation	22
8.	Dr. Bimalkumar K. Joshi A Comparison of Self-Concept between Player and Non- Player Students	25
9.	Dr. Shweta N.Dave hawk-eye"-modern technology in cricket	29
10.	Dr. Dharmashih B Desai, Dr. Ramesh J. Chaudhri "A Comparative study of Economic and social level with reference to anxiety and adjustment of students of physical education colleges of Gujarat State"	35
11.	Dr. Pinal D Solanki rhythmic education, objectives before a discipline	38
12.	Dr. Vishnubhai G. Chaudhari Effects of Plyometric Training and Pranayama on physiological variable of school students.	42
13.	Dr. Ajitsinh A. Thakor Effect Of Yogasana On BMI & Waist/Hips Ratio Among College Students	49
14.	Dr. Manoj Parmar effect of meditation on selected coordinative abilities"	55
15.	Rahul Chavda, (Ph.D. Scholar), Dr. P. C. Chavda, Hypokinetic Disease and Exercise	58
16.	Dr. G. A. Desai, Pro. R. B. Solanki Effect of Yogaasana and pranayama on selected physiological variables	61

Effect of Yogaasana and pranayama on selected physiological variables

Dr. G. A. Desai, Associate Professor, Arts College, Vadali

Pro. R. B. Solanki, Associate Professor, Arts & Commerce Collage, Talod

ABSTRACT

The objective of the study was the Effect of Yogasana and pranayama on selected physiological variables of College student of the Arts College, Vadali. For the purpose of the study (N- 45) College Boys assigned randomly selected as subject. Age of the selected subjects was ranged from 18 to 22 years. The subjects were divided into three equal groups Group A given the training on Yogasana and pranayama for a period of six weeks on six days per week except Sunday. The group B has given the training on Yogasana and pranayama for a period six week on alternative days three days per week. The group C served as the control. Blood pressure, cardiovascular endurance, BMI and Breath holding capacity were considered as the selected physiological variables for the study. All the groups were subjected to pre-test prior to the experimental treatment. The experimental groups participated in their respective duration of 6 weeks, six days in a week throughout the study. Period of six weeks analysis of 't' test and analysis of ANCOVA was adopted. The level of significance was 0.05.

The result showed that the experimental group - A trained by Yogasana and Pranayama showed improvement thought statistically no significant gain the performance. The experimental group - B trained by Yogasana and Pranayama showed no significant differences in systolic and diastolic blood pressure cardiovascular endurance and body composition.

Keywords : Blood pressure, cardiovascular endurance, BMI, Breath holding etc.

1. Introduction

Yog is the greatest Indian concept annunciated to the world. The words Yogasana and Pranayama always used in Vedas, Upanishads, Gita and mythological scriptures etc. since ancient times. When the concept of Pranayama in its most obvious and technical form, the term Prana means breathing activity and Ayama means restrain, control or the conscious manipulation. Yoga is the art and science of living and is concerned with the evolution of mind and body. Pranayama, or breathing techniques, are important not only for supplying fresh oxygen and strengthening the lungs but because they have a direct effect on the brain and emotions. The creative energies in a constructive way, and child exhibits more self-confidence, self-awareness and self-control.

Pranayama removes veil of ignorance, untruth, and afflictions from the mind while Pranayama is relatively more effective on the level of subtle bodies although the physical body also benefits from it. Lungs, heart and brain are important parts of our body and the health of one is affect by the health of others. Pranayama is a system of rhythmic breathing, which strengthens the lung, normalizes blood circulation, thereby curing all diseases and giving longevity. Yoga is a form of complete education that can be used with all students because it develops physiological variables and intellectual and creative talents. In this study a sincere effort has been made to investigate the effects of yogasana and pranayama on physiological variables of College students.

Modern Trends in Physical Education, Sports and Yogic Science



: Editors :

► Dr. Ramesh J. Chaudhari ◆ Dr. Dharmashih B. Desai ◆ Prof. Manoj N. Parekh

Akshar Book Agency, Ahmedabad

Sr.	Name of the Participants	Title	Page No.
26	Dr. Suresh P. Patel	आधुनिक योग में योग का महत्व Issue of Doping and Role of WADA	79
27	Dr. V. K. Chavda	A Comparative Study On Physical Fitness Components Between Basketball And Handball Players At University Levels	81
28	Dr. Namrata Acharya	YOGA AS A CAREER; Present and Future	83
29	Dr. Sugnesh Chudasama	The study on Intelligence Quotient and Academic	85
30	Dr. Bhemjibhai N. Patel	Achievement of Poverty Line Family's College Male Students Media and sports	87
31	Dr Harjit Kaur	Globalization of Yoga for Sustainable Mental Health and Peace	93
32	Dr. Laxmanbhai K. Parmar	A Comparative Study of Selected Physiological Variables on	95
33	Dr. Parixitsinh D. Mandora	Judo & Wrestling Players	102
34	Dr. Jashabhai Gopalbhai Patel Prof. Manoj N. Parekh	परंपरागत भारतीय खेलों का सामाजिक दर्शन	105
35	Dr. Vikas Prajapati	Comparision of Leadership Behaviour and Competative Behaviour Amongst Female Football and Hockey Players	107
36	Dr. Yogesh B. Jani Dr. Bharat M. Patel Dr. Kanu M. Chaudhari	Effects of Classified Exercise on Selected Physiological Variables of Divyang (Mentally Challenged) Children	109
37	Dr. Tanvi Tarpara Dr. Dilip Gholap Dr. Mayur Patel	Use of Virtual Reality Technology in Sports and Physical Education	115
38	Dr. Karsan N. Ravat	सेहत और मानसिक तनाव के संचालन के लिए स्पोर्ट्स और योग	12
39	Dr. Dharmendra K. Dhanula	Effect of Parent Literacy on Physical Fitness of their Son	12
40	Prof. Devendrasinh B. Rana	DOPING IN SPORTS	12
41	Ms. Bharti J. Brahmbhatt	Issue of Doping and Role of Wada	12
42	Dr. Dipak K. Sheth	Issue of Doping and Role of Wada	13
43	Dr. Mukesh Patel Dr. Bharat Patel	A Study on Effects of Aerobics and Circuit Trainings on Speed,	1
44	Prof. Narendrasinh S. Chaudhari Prof. Ashokbhai G. Patel	Understanding Participation in Sport and Physical Activity Among Children and Adults	1
45	Dr. Rameshbhai D. Chaudhari	Analysis of Speed on Among College, District, University and State Level Volleyball Teams	1
46	Dr. Rameshchandra H. Patel	Importance of Sports Psychology in Physical Education and Sports	1
47	Dr. Sanjay S. Dabhade	Issue of Doping and Role Of WADA	
48	Prof. Kirit J. Roy	Modern Trend of Educational Technology in Physical Education of Colleges and Universities	
49	Dr. Ajitkumar Jivanlal Parmar Prof. Jayeshkumar B. Parmar	Role of Management in Sports	
50	Dr. Jayendrasinh P. Thakor	Health Benefits of Yoga For Women	
51	Dr. Bimalkumar K. Joshi	Effectiveness of Skill related Circuit Training on Game Skill of boys players of Cricket games	
52	Prof. Dilip G. Chaudhary	Importance of Aerobic and Anaerobic Capacity in Fitness	
53	Dr. Gandabhai A. Desai	Spots and Fitness	
54	Prof. Kailasgiri K. Goswami Dr. Pravinkumar V. Chaudhary	Yoga career scope, eligibility and job prospect in present and future	

SPORTS & FITNESS

Dr. Gandabhai A. Desai
Dept. Of Phy Edu. Arts College, Vadodara

ABSTRACT:-

The best sports for fitness are the ones in which you exercise continuously, those that are least likely to injure you and the ones you enjoy the most. You become fit by exercising vigorously enough to increase the circulation of blood. It makes no difference to your heart how you increase your circulation. The best sports for fitness use your legs because the blood vessels in your legs are so much larger than you can circulate for more blood with your leg muscles. Further, more arm exercise tire you earlier because most people have weaker arms.

Sports can be a great way to get in shape or stay that way. Having a specific goal can be a great motivator physically, you need strength and endurance. Your training will vary with your sport. You would not train the same way for pole vaulting as for swimming. You might, however, cross train, cross training simply means that you include a variety of fitness activities in your program. Research shows that cross training builds stronger bones. Some sports require a great level of fitness just to start. For Example, to jump Rope, you must spine the rope more than 80 times a minute to keep it from tangling. Many people cant jump 80 times a minute. The safest sports are low-impact Aerobics, Walking, Swimming and Pedaling a stationary Bycycle. Running causes lots of injuries, because the force of your foot striking the ground can be three times your body weight, which can damage mussels and bones.

INTRODUCTION:-

Physical fitness is the bodies ability to function efficiently and effectively. It consists of health - related physical fitness and skill related physical fitness, which has at least 11 different components, each of which contributes to total quality of life. Physical fitness is associated with a persons ability to work effectively, enjoy leisure time, be healthy, resist hypo kinetic diseases, and meet emergency situations. It is related to, but different from health, wellness, and the psychological, sociological.

Emotional and spiritual components of fitness. Although the development of physical fitness is the result of many things, optimal physical fitness is not possible without regular exercise. Sports plays a wonderful role in fitness. Sport is the application of fitness in a fantastic atmosphere of competition and mastery. Training efforts typically include relatively predictable repetitive movements and provide limited opportunity for the essential combination of our ten general physical skills. It is after all the combined expression, or application, of the ten general skills that is our motivation for their development in the first place. Sports and games like soccer, martial arts, baseball, and basketball in contrast to our training workout have more varied and less predictable movements. But, where sports develop and require all ten general skills simultaneously, they do so slowly compared to our strength and conditioning regimen. Sport is batter, in our view, at expression and testing of skills than it is at development are crucial to our fitness. Sport in many respects more closely mimics the demands of nature than does our training. We encourage and expects our athletes to engage in regular sports effort in addition to all of their strength and conditioning work.

Unlike most attributes, defining physical fitness is not a subjective matter; in fact determining what it means to be physically fit can be a matter of life and death. Some of the physiological characteristics most often characterized as a measure of physically fitness are, Cardio respiratory endurance , muscular strength and endurance , body composition, flexibility and mental clarity.

MAKING A COMMITMENT:-

You have taken the important first step on the path to physical fitness by seeking information. The next step is to decide that you are going to be physically fit. This pamphlet is designed to help you reach that decision and your goal. In the following pages you will find the basic information you need to begin and maintain a personal physical fitness program. These guidelines are intended for the average healthy adult. It tells you what your goals should be and how often, how long and how hard you must exercise to achieve them. It also includes information that will make your workouts easier, safer and more satisfying. The rest is up to you.

**1 - VANRAJ CHAVADA & ESTABLISHMENT OF ANHILPUR PATAN - DR. J.G.CHAUDHARI
2 - ACHIEVEMENTS BEFOUR MULRAJ SOLANKI & BHIMDEV - 1 - DR. J.G.CHAUDHARI**



ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી
(ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત)

પ્રથમ વર્ષ બી.એ. - ઇન્ફિલ્યુસ્ટ્રીશ
પેપર - ૨
(મુખ્ય તથા મૌલિક)
HISM / HISS-102
ગુજરાતનો ઇન્ફિલ્યુસ્ટ્રીશ
(પ્રોફેન્શિયલ પુનર્ની ઈ.ક્ર. ૧૩૦૭ સુધી)






વિભાગ-૩ ચાવડાવંશ થી સોલંકી યુગ સુધી



યુનિવર્સિટી ગીત

નવાયાણ પરમે તથ;
સ્વાયાણ પરમે તથ;
બ્રાયાણ પરમે તથ;

શિશ્યાણ સંભેદાતિ, મદ્ધભાવ, દિવ્યબોધનું પામ
ડી. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી નામ,
જોને સૌંદર્ય પોણ મળે, ન જોને સૌંદર્ય આપ,
દરે ડિગ્રીઓ વાંચે દરે દશે સુખ-લાભ.

માનબન રહી અણાનના શાને, અફકારને પાવો ?
કરે ખુલ્લ અમબેડકર મોટે, તુ થી તારો દ્રારો;
શરૂઆતની અદ્વાતા પદ્ધત્યા ગુજરાત જામે જામ
મુવ તારકની જેમ જગતને એવાખ્યાતી શાન.

સરસવાતીના બધુર તમારે કણિયે આવો જાણેકે
અફકારને ઉલ્લંઘને ઉલ્લંઘન કરે મંડેકે;
અધ્યાત્મ કો ત્રયાન જામણના જરૂર ન હશ્યો દૂર
પર આવો મા કરે શરૂઆત હેઠ નિર્મિતા પૂર્ણ.


સંસ્કારોની કુંઘેય મહોદે, મન મહિદને પામે
સુધાની રાયાં પદ્ધતે જોને પોતાને સરનામે;
સમજ કરે દરિયે લાંદી વિશ્વાસ કરે વરાણ,
આપો કરેં આપણ કો
અથ રાણ નિર્મિતિ...
દિવ્ય રાણ નિર્મિતિ...
અથ રાણ નિર્માણ

DR. BABASAHEB AMBEDKAR OPEN UNIVERSITY
(Established by Government of Gujarat)
"Jayanti" Parivar,
Sarkhej-Gandhinagar Highway, Gandhinagar-382 481
Website : www.baou.edu.in



 <p>ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી (ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત)</p> <p>HISM/HISS-102 ગુજરાતનો ઇન્ફિલ્યુસ્ટ્રીશ (પ્રોફેન્શિયલ પુનર્ની ઈ.ક્ર. ૧૩૦૭ સુધી)</p> <p>વિભાગ-૩ ચાવડાવંશ થી સોલંકી યુગ સુધી</p>																																					
વેક્ટર્સ-૩ ચાવડાવંશ થી સોલંકી યુગ સુધી	4 /																																				
<p>એકમ-૧ ધનરાજ ચાવડા અને અજુનિવનાડ પાટદાની રૂપરણા</p> <p>એકમ-૧૦ મુજશાજ તથા ભીમદેવ-૧ પહેલાની સિધ્યાઓ</p> <p>એકમ-૧૧ સિક્કરાજ જ્યાસિની રાજકીય સિપ્પાણે</p> <p>એકમ-૧૨ કુમારપાળની રાજકીય સિક્કાઓ</p> <p>એકમ-૧૩ કુમારપાળની સાસુનિક સિક્કાઓ</p> <p>એકમ-૧૪ હેમવાદયે અને તોમણુ સિધ્ય મંડતા</p>	<p>સેપાદાન:</p> <table border="1"> <tbody> <tr> <td>ડૉ. કૃષ્ણ કુંભાયા</td> <td>નિયમામ, મૂલ ઓફ સુનિવિલીઝ એન્ડ સોન્ટલ સરનામીના, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી, અમદાવાદ.</td> </tr> <tr> <td>ડૉ. સોનાલ ગોપની</td> <td>અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી, અમદાવાદ.</td> </tr> </tbody> </table> <p>વિષય સમેનિ:</p> <table border="1"> <tbody> <tr> <td>ડૉ. સોનાલ ગોપની</td> <td>અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી, અમદાવાદ</td> </tr> <tr> <td>ડૉ. અનુકુ પાપેલ</td> <td>પોઝિસર અને અધ્યક્ષ, ઇન્ફિલ્યુસ્ટ્રીશ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ</td> </tr> <tr> <td>ડૉ. લાલિત પટેલ</td> <td>પોઝિસર, ડોચર્ની પો.કે. કોટાશાહ અન્ડેસ કોલેજ, પાટા</td> </tr> </tbody> </table> <p>પરામર્થન (વિષય):</p> <table border="1"> <tbody> <tr> <td>ડૉ. અનુકુ પાપેલ</td> <td>પોઝિસર અને અધ્યક્ષ, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ</td> </tr> <tr> <td>ડૉ. અગનિશ વીપની</td> <td>પોઝિસરાયા, કેસ, વી. આન્ડેસ કોલેજ, અમદાવાદ</td> </tr> <tr> <td>ડૉ. અનલલાય કોણાણી</td> <td>પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, રાજકોટ.</td> </tr> </tbody> </table> <p>લેખન:</p> <table border="1"> <tbody> <tr> <td>ડૉ. સંજય પટેલ</td> <td>અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, સરકારી આઈસ કોલેજ, જામી</td> </tr> <tr> <td>ડૉ. કાશીરાજ ગોપની</td> <td>અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, આઈસ એન્ડ કોલેજ, જામી</td> </tr> <tr> <td>ડૉ. આનિલ પરમાર</td> <td>અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ</td> </tr> <tr> <td>ડૉ. કેશસ પટ્ટાણ</td> <td>અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, નવજીવન આઈસ એન્ડ કોલેજ, રાણી</td> </tr> </tbody> </table> <p>પરામર્થન (સાધન):</p> <table border="1"> <tbody> <tr> <td>ડૉ. કૃષ્ણ કુંભાયા</td> <td>અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી</td> </tr> <tr> <td>ડૉ. અગનિશ વીપની</td> <td>અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી</td> </tr> <tr> <td>ડૉ. કુંભાયા</td> <td>અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી</td> </tr> </tbody> </table> <p>પરામર્થન (સાધન):</p> <table border="1"> <tbody> <tr> <td>ડૉ. કૃષ્ણ કુંભાયા</td> <td>અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી</td> </tr> <tr> <td>ડૉ. અગનિશ વીપની</td> <td>અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી</td> </tr> <tr> <td>ડૉ. કુંભાયા</td> <td>અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી</td> </tr> </tbody> </table> <p>પરામર્થન: ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી, અમદાવાદ</p>	ડૉ. કૃષ્ણ કુંભાયા	નિયમામ, મૂલ ઓફ સુનિવિલીઝ એન્ડ સોન્ટલ સરનામીના, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી, અમદાવાદ.	ડૉ. સોનાલ ગોપની	અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી, અમદાવાદ.	ડૉ. સોનાલ ગોપની	અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી, અમદાવાદ	ડૉ. અનુકુ પાપેલ	પોઝિસર અને અધ્યક્ષ, ઇન્ફિલ્યુસ્ટ્રીશ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ	ડૉ. લાલિત પટેલ	પોઝિસર, ડોચર્ની પો.કે. કોટાશાહ અન્ડેસ કોલેજ, પાટા	ડૉ. અનુકુ પાપેલ	પોઝિસર અને અધ્યક્ષ, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ	ડૉ. અગનિશ વીપની	પોઝિસરાયા, કેસ, વી. આન્ડેસ કોલેજ, અમદાવાદ	ડૉ. અનલલાય કોણાણી	પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, રાજકોટ.	ડૉ. સંજય પટેલ	અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, સરકારી આઈસ કોલેજ, જામી	ડૉ. કાશીરાજ ગોપની	અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, આઈસ એન્ડ કોલેજ, જામી	ડૉ. આનિલ પરમાર	અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ	ડૉ. કેશસ પટ્ટાણ	અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, નવજીવન આઈસ એન્ડ કોલેજ, રાણી	ડૉ. કૃષ્ણ કુંભાયા	અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી	ડૉ. અગનિશ વીપની	અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી	ડૉ. કુંભાયા	અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી	ડૉ. કૃષ્ણ કુંભાયા	અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી	ડૉ. અગનિશ વીપની	અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી	ડૉ. કુંભાયા	અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી
ડૉ. કૃષ્ણ કુંભાયા	નિયમામ, મૂલ ઓફ સુનિવિલીઝ એન્ડ સોન્ટલ સરનામીના, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી, અમદાવાદ.																																				
ડૉ. સોનાલ ગોપની	અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી, અમદાવાદ.																																				
ડૉ. સોનાલ ગોપની	અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી, અમદાવાદ																																				
ડૉ. અનુકુ પાપેલ	પોઝિસર અને અધ્યક્ષ, ઇન્ફિલ્યુસ્ટ્રીશ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ																																				
ડૉ. લાલિત પટેલ	પોઝિસર, ડોચર્ની પો.કે. કોટાશાહ અન્ડેસ કોલેજ, પાટા																																				
ડૉ. અનુકુ પાપેલ	પોઝિસર અને અધ્યક્ષ, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ																																				
ડૉ. અગનિશ વીપની	પોઝિસરાયા, કેસ, વી. આન્ડેસ કોલેજ, અમદાવાદ																																				
ડૉ. અનલલાય કોણાણી	પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, રાજકોટ.																																				
ડૉ. સંજય પટેલ	અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, સરકારી આઈસ કોલેજ, જામી																																				
ડૉ. કાશીરાજ ગોપની	અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, આઈસ એન્ડ કોલેજ, જામી																																				
ડૉ. આનિલ પરમાર	અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ																																				
ડૉ. કેશસ પટ્ટાણ	અસિસ્ટન્ટ પોઝિસર, ઇન્ફિલ્યુસ્ટ્રીશ વિભાગ, નવજીવન આઈસ એન્ડ કોલેજ, રાણી																																				
ડૉ. કૃષ્ણ કુંભાયા	અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી																																				
ડૉ. અગનિશ વીપની	અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી																																				
ડૉ. કુંભાયા	અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી																																				
ડૉ. કૃષ્ણ કુંભાયા	અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી																																				
ડૉ. અગનિશ વીપની	અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી																																				
ડૉ. કુંભાયા	અસિસ્ટન્ટ પોઝિસર, ગુજરાતી, ડૉ. બાબાસાહેબ અમબેડકર યોપન યુનિવર્સિટી																																				

SHABDVIMARSH - DR.P.R.PATEL



ISBN : 978-81-942321-3-1